

Seat No. : \_\_\_\_\_

**MO-134**

March-2019

**B.Sc., Sem.-VI**

**CC-309 : Zoology**

**(Animal Biochemistry & Metabolism)**

**Time : 2:30 Hours]**

**[Max. Marks : 70]**

**સૂચના :** બધા જ પ્રશ્નો ફરજિયાત છે.

1. (A) નોંધ લખો :

- (i) ફેટી એસીડ્સ  
(ii) ઉત્સેચક નામકરણ

7  
7

**અથવા**

- (i) શોસ્ફોગ્લીસરાઇડ્સ  
(ii) “આઈસોમેરેસીસ” અને “ડ્રાન્સફેરેસીસ”

(B) ટૂંકમાં જવાબ આપો : (કોઈપણ ચાર)

4

- (1) હેલોજનેશન શું છે ?  
(2)  $\beta$  સ્ટીઅરો - $\alpha$ - $\alpha'$  ઓલીઓપામીટીનનું બંધારણ લખો.  
(3) વ્યાખ્યા : ખોરાશ  
(4) સ્ટીરોઇડ ન્યુક્લીઅસ શું છે ?  
(5) ઉત્સેચક મહત્તમ કિયા ક્યારે દશાવિ છે ?  
(6) ઉત્સેચકીય પ્રક્રિયામાં “લાયેસીસ” એ “લીગેસીસ” થી કેવી રીતે જુદા પડે છે ?

2. (A) સમજાવો :

- (i) પેન્ટોજ ફોર્મેટ પથનો ઓક્સિಡેટીવ તબક્કો  
(ii) કંકાલ સ્નાયુમાં ખાયકોજુનોલાયસીસ

7  
7

**અથવા**

- (i) ખાયકોલીસીસની શોસ્ફોરાયલેશન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ  
(ii) ચૃકૃતમાં ખાયકોજન સંશોધણ (ફ્રેન્ટ ચાર્ટ)

(B) ટૂંકમાં જવાબ આપો : (કોઈપણ ચાર)

- (1) એમ્ફીબોલીકની વ્યાખ્યા ઉદાહરણ સાથે.
- (2) ખાયકોલીસીસની અપ્રતિવર્તી પ્રક્રિયાઓ કઈ છે ?
- (3) UDPG શું છે ?
- (4) HMP શંટનું મહત્વ
- (5) કાર્બોહિટ ચયાપચય સાથે સંકળાયેલ કોઈપણ બે અંતઃખાવ
- (6)  $\text{NAD}^+$  અને  $\text{NADH}$  વચ્ચેનો તફાવત શું છે ?

3. (A) સમજાવો :

- (i) પાયર્વીક એસીડમાંથી ખુકોજનું નિર્માણ
- (ii) ઈલેક્ટ્રોન પરીવહન તંત્ર

**અથવા**

- (i) એસીટાઈલ Co. A માંથી  $\alpha$  - કીટોખુટારેટનું નિર્માણ
- (ii) ગેલેક્ટોજમાંથી ખુકોજ સંશોધણ.

(B) ટૂંકમાં જવાબ આપો : (કોઈપણ ત્રણ)

- (1) ઓક્સિડેટીવ ફોર્માટાયલેશન શું છે ?
- (2) કોઅન્જાઈમ Q શું છે ?
- (3) TCA ચકનો એનાભોલીક ફાળો
- (4) નીઓખુકોજનેસીસના કોઈપણ બે પ્રક્રિયકના નામ.
- (5) અજારક શ્વસન એટલે શું ?

4. (A) સમજાવો :

- (i) ડીકાર્બોક્સલેશન
- (ii) પામીટીક એસીડનું વિઘટન

**અથવા**

- (i) ઓન્નાથીન ચક (ફૂલ ચાર્ટ)
- (ii) ખ્લીસરોલ કેટાબોલીસમ ATP નિર્માણ સાથે

(B) ટૂંકમાં જવાબ આપો : (કોઈપણ ત્રણ)

- (1) એમીનો એસીડના વિઘટન માટે કઈ પ્રક્રિયા છે ?
- (2) ડીએમીનેશનનું ઉદાહરણ.
- (3)  $\beta$ -ઓક્સિડેશનના એક ચક દરમ્યાન ઉત્પન્ન થતા ATP ના આગુંઓ.
- (4) પ્રોટીન ચયાપચયમાં SGPT નો ફાળો.
- (5) બાયોજેનીક એમાઇન્સના ઉદાહરણો

**MO-134**

March-2019

**B.Sc., Sem.-VI****CC-309 : Zoology****(Animal Biochemistry & Metabolism)****Time : 2:30 Hours]****[Max. Marks : 70]****Instruction :** All questions are compulsory.

1. (A) Write note on :  
 (i) Fatty acids  
 (ii) Enzyme nomenclature 7  
**OR**  
 (i) Phosphoglycerides  
 (ii) "Isomerases" and "Transferases" 7
- (B) Answer in brief : (any four) 4  
 (1) What is halogenation ?  
 (2) Draw the structure of  $\beta$  stearo- $\alpha$ - $\alpha'$  oleopalmitin.  
 (3) Define : Rancidity.  
 (4) What is steroid nucleus ?  
 (5) When does the maximum activity of the enzyme occur ?  
 (6) How Lyases are different from Ligases in enzymatic process ?
2. (A) Explain :  
 (i) Oxidative phase of pentose phosphate pathway.  
 (ii) Glycogenolysis in skeletal muscle. 7  
**OR**  
 (i) Phosphorylation and oxidation reactions of glycolysis.  
 (ii) Glycogen synthesis in liver (only chart). 7
- (B) Answer in brief : (any four) 4  
 (1) Define Amphibolic giving example.  
 (2) Which are the irreversible reactions of glycolysis ?  
 (3) What is UDPG ?  
 (4) Importance of HMP shunt.  
 (5) Any two hormones involved in carbohydrate metabolism.  
 (6) What is the difference between  $\text{NAD}^+$  and  $\text{NADH}$  ?

3. (A) Explain :

- (i) Synthesis of glucose from pyruvic acid.  
(ii) Electron transport system.

**OR**

- (i) Formation of  $\alpha$ -ketoglutarate from acetyl CoA.  
(ii) Synthesis of glucose from galactose.

(B) Answer in brief : (any three)

- (1) What is oxidative phosphorylation ?  
(2) What is coenzyme Q ?  
(3) Anabolic role of TCA cycle.  
(4) Name any two substrates of Neoglucogenesis.  
(5) What is anaerobic respiration ?

4. (A) Explain :

- (i) Decarboxylation  
(ii) Lysis of Palmitic acid

**OR**

- (i) Ornithine cycle  
(ii) Glycerol catabolism with ATP production

(B) Answer in brief : (any three)

- (1) What is the process of breakdown of amino acids ?  
(2) Example of deamination.  
(3) How many ATPs are formed from one turn of  $\beta$ -oxidation ?  
(4) Role of SGPT in protein metabolism.  
(5) Examples of Biogenic amines.

7

7

3

7

7

3